





**FOR RESIDENTIAL PURPOSE
FOR N.A. PURPOSE ONLY**

SHYAM PARK



२-११२६५१ भारता मा.प.स.मा.स.
BHARTBHAI UKABHAI SORATHIYA

OWNER :-


M. P. Sorathiya
M. P. SORATHIYA
 Consulting Engineer
 "Vrundavan" R. N. Society
 K. J. Vekariya Road, RAJKOT - 3
 R.M.C. LIC. No. - P-403
 RUDA LIC. No. - S-190

ENGINEER :-

TRUE COPY

SARJUDAS J. DUDHREJIA
ADVOCATE & NATORY.
RAJKOT.

Page No. 8612028
Serial No. 1956
Receipt No. 1956
Date. 10-4-2028



Permission Of This Subplotting Plan
Is Issued Only For Subplot No.
(17038)


સદર વિસ્તાર ની ટી. પી. સ્કીમ અન્યથે આ,
સત્તામંડળ દ્વારા ટોટલ રેસેનશની માપણી કરવામાં,
આવેલ છે. ભવિષ્યમાં આ સત્તામંડળ દ્વારા સ્કીમ,
બનાવવાનો ઇષ્ટો જરૂર કરવામાં આવે અને તે અંગે,
ડી. આઈ. એલ. આર. કચેરી દ્વારા માપણી/રેકર્ડ,
પ્રમાણિત કરતા કોઈપણ ફેરફાર થશે તો તે તમામ રેકર્ડ,
ફાઈલ્સ/તમામ જમીન માલિકોને બંધાવવામાં આવશે.

સદર વિસ્તાર ની ટી. પી. સ્કીમ અન્યથે આ,
સત્તામંડળ દ્વારા ટોટલ રેસેનશની માપણી કરવામાં,
આવેલ છે. ભવિષ્યમાં આ સત્તામંડળ દ્વારા સ્કીમ,
બનાવવાનો ઇષ્ટો જરૂર કરવામાં આવે અને તે અંગે,
ડી. આઈ. એલ. આર. કચેરી દ્વારા માપણી/રેકર્ડ,
પ્રમાણિત કરતા કોઈપણ ફેરફાર થશે તો તે તમામ રેકર્ડ,
ફાઈલ્સ/તમામ જમીન માલિકોને બંધાવવામાં આવશે.

APPROVED as amended in and subject to conditions mentioned in this office letter No. Ruda / Tech / Dev /
Dated..... 6.11.07..... 2007/34310

JUNIOR TOWN PLANNER
RAJKOT URBAN DEVELOPMENT AUTHORITY
RAJKOT

AUTHORITY :-




AREA - TABLE


PLOT No.	SQ. MT.	SQ. YD.	PLOT No.	SQ. MT.	SQ. YD.	PLOT No.	SQ. MT.	SQ. YD.
1	541.94	648.16	14	73.55	87.97	27	73.56	88.00
2	73.55	87.97	15	68.07	81.41	28	73.58	88.00
3	73.55	87.97	16	76.46	91.45	29	73.58	88.00
4	73.55	87.97	17	490.35	566.46	30	73.58	88.00
5	73.55	87.97	18	391.24	467.92	31	73.58	88.00
6	73.55	87.97	19	505.16	604.17	32	73.58	88.00
7	73.55	87.97	20	413.31	494.32	33	73.58	88.00
8	73.55	87.97	21	551.35	659.41	34	73.58	88.00
9	73.55	87.97	22	402.66	481.58	35	73.58	88.00
10	73.55	87.97	23	467.18	558.75	36	73.58	88.00
11	73.55	87.97	24	581.10	695.00	37	73.58	88.00
12	73.55	87.97	25	76.51	91.51	38	504.51	603.39
13	73.55	87.97	26	68.11	81.46	-	-	-

	sq. mt.	sq. yd.
TOTAL LAND AREA	13962.00	16698.55
PROPOSED NETWORK & T.P.S. ROAD AREA	3557.47	4254.73
PROPOSED T.P. RESERVATION	2027.33	2424.69
TOTAL T.P. PROPOSED RESERVATION	5584.80	6679.42
NET LAND AREA (60%)	8377.20	10019.13
TOTAL PLOT AREA (1 to 38)	6903.48	8256.56
COMMON PLOT AREA	837.77	1001.97
INTERNAL ROAD AREA	635.95	760.80
NET LAND AREA FOR N.A.	8377.20	10019.13

ad-Pont



૧. સદરહુ જમીનનો ઉપયોગ કરતા પહેલા લેન્ડ રેવન્યુ કોડની કલમ-૬૫ અન્વયેની સંબંધિત સક્ષમ અધિકારીશ્રીની જરૂરી પરવાનગી લેવાની રહેશે. તેમજ બિનખેતી કરાવ્યા બાદ ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ ની કલમ - ૨૬, ૨૮ માં જણાવ્યા પ્રમાણેનું કોઈપણ વિકાસ કાર્ય કરતા પહેલા રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની જરૂરી બાંધકામની મંજૂરી મેળવવાની રહેશે. અન્યથા કરેલ બાંધકામ બિનઅધિકૃત ગણાશે.
૨. ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ની જોગવાઈ અન્વયે સદરહુ જમીનનો વિકાસ, વિકાસ યોજનાની અને નગર રચના યોજનાની દરખાસ્તો અને નિયમો મુજબ કરવાનો રહેશે.
૩. વિકાસ પરવાનગી, સર્વે નંબર/બ્લોક નંબર અથવા ખંડ અગર પ્લોટમાં અરજદાર જે જમીનમાં માલિક કે જમીન પુરતી પરવાનગી આપવામાં આવે છે.
૪. નગર રચના યોજના નં. નગર રચના અધિકારીશ્રી ધ્વારા અંતિમ કરતા જે કંઈ ફેરફાર થશે તે બંધનકર્તા રહેશે.
૫. સવાલવાળી જમીનની માલિકી હકક, હિત, હિસ્સા, ક્ષેત્રફળ, હદના માપો, સ્થળ સ્થિતિ, પ્રવેશ, કુલ મુખત્યારનામુ, વિગેરેની ચકાસણી સક્ષમ અધિકારીશ્રીએ કરી લેવાની રહેશે.
૬. વિકાસ નકશામાં જુના જુદા વિસ્તારમાં જમીનનો અને મકાનના ઉપયોગ વિશે જે ખાસ નિયમો હશે તેની વિરુદ્ધનો ઉપયોગ કરી શકશે નહીં તેમજ વિકાસ પરવાનગી માંગણી વખતે નકશાના દરેક ખંડનો જે ઉપયોગ હશે તેથી જુદો ઉપયોગ અગાઉથી મંજૂરી લીધા સિવાય કરી શકશે નહીં.
૭. સદરહુ પત્રની અંદર બતાવેલ શરતોમાંથી કોઈપણ શરતોનો ભંગ કરવામાં આવશે તો શહેરી વિકાસ સત્તામંડળ તે શરતોનો અમલ કરાવી શકશે અને શહેરી વિકાસ સત્તામંડળના તેવા કૃત્યને લીધે નુકશાન, ખોટ કે હરકત માલિકને થાય તે બદલ કંઈપણ બદલો મળી શકશે નહીં.
૮. સદરહુ ભલામણ સત્તામંડળના પ્રવર્તમાન નિયમો મુજબ આપવામાં આવી છે. અને ખાનગી હકકોના નુકશાની અંગે સત્તામંડળની કોઈપણ જવાબદારી રહેતી નથી.
૯. વિકાસ પરવાનગી સત્તામંડળના અધિકારી જોવા માંગે તો તે બતાવવા માલિક બંધાયેલા છે. જો તે નહિ બતાવે તો તે કામ બંધ કરવા હુકમ કરશે અને તે મુજબ કામ બંધ કરવાનું રહેશે. તેમજ વિકાસ પરવાનગી સાથે મંજૂર કરાયેલ નકશાઓનો (લેમીનેટેડ કરાવેલ) એક સેટ/નકલ સ્થળ પર રાખવાનો રહેશે. તેમજ વિકાસ પરવાનગીની નંબર તારીખ તેમજ જમીનની વિગતો દર્શાવતુ બોર્ડ પણ સ્થળે પ્રસિધ્ધ કરવાનું રહેશે.
૧૦. બે રસ્તાના કે ત્રણ રસ્તાના પ્લોટમાં ભવિષ્યમાં બાંધકામ કરતા પહેલા તમામ રોડ સાઈડ પર નિયમાનુસાર માર્જીન છોડવાના રહેશે.
૧૧. વખતો વખત શહેરી વિકાસ સત્તામંડળ તરફથી તથા સરકારશ્રી તરફથી વિકાસ માટેના જે નિયમો કે સૂચનાઓ જાહેર કરાય તે બંધનકર્તા રહેશે.
૧૨. અરજદાર આ સત્તામંડળ તથા સરકારશ્રી વખતો વખત નકકી કરે તે મુજબના ડેવલપમેન્ટ ચાર્ટર્સ, અન્ય ચાર્ટર્સ, ડીપોઝીટ તેમજ ફી ભરવા જવાબદાર રહેશે.
૧૩. ઉપર જણાવેલ શરતોનો ભંગ કરવા બદલ ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ ધારો-૧૯૭૬ ની કલમ - ૨૮/૫, ૩૫, ૩૬, ૩૭ વિગેરેની જોગવાઈ મુજબ દંડ તથા શીક્ષાને પાત્ર રહેશે.



૨ બોજા હશે તો ધિરાણ કરનાર સંસ્થાના ધોરણો તેમને બંધનકર્તા રહેશે.
૩ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ-૧૯૭૬ સિવાયના બીજા પ્રવર્તમાન
૪ મંજૂરીને આધિન રહીને વિકાસ પરવાનગી અંગે ભલામણ કરવામાં આવે

૧૬. રજુ થયેલ નકશામાં દર્શાવ્યા મુજબના વિકાસ કરતા પહેલા યોગ્ય તે અધિકૃત પ્રવેશ મેળવી લેવાનો રહેશે. અને પ્રવેશ અંગેની યોગ્યતા, રસ્તાની પહોળાઈ બાબતેની ખરાઈ સક્ષમ અધિકારીશ્રીએ કરી લેવાની રહેશે.

૧૭. ઔદ્યોગિક/વાણિજ્ય બાંધકામને લગતા સરકારશ્રીનાં જુદા-જુદા ખાતાઓના નીતિ નિયમો પણ અરજદારશ્રીને બંધનકર્તા રહેશે તેમજ તે અંગેના જરૂરી તમામ "ના-વાંધા પ્રમાણપત્રો" મેળવી લેવાનું રહેશે.

૧૮. માર્જીન વાળા ભાગમાં, આંતરીક રસ્તાઓપર અને કોમન પ્લોટમાં કોઈને અંતરાયરૂપ ન થાય તે રીતે યોગ્ય સ્થળોએ કુલ જમીનનાં વિસ્તારની ગણતરી મુજબ ૮૦ ચો.મી. દીઠ - ૧ (એક) વૃક્ષ પ્રમાણેના વૃક્ષો વાવવાના તથા ઉછેરવાના રહેશે.

૧૯. વરસાદી કુદરતી પાણીના વહેણને અવરોધ ન થાય તેનો યોગ્ય રીતે સરળતાથી નિકાલ થાય તેવી જરૂરી વ્યવસ્થા કરવાની રહેશે.

૨૦. ઉપરોક્ત જણાવેલ કંઈપણ શરતોનો ભંગ થશે તો આપેલ વિકાસ પરવાનગી આપોઆપ રદ થયેલી ગણાશે.

૨૧. માલિકને વિકાસ માટેની પરવાનગી આપવામાં આવી હશે તો પણ તેમણે ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ મુજબ નગર રચના યોજના માટે ફાળો આપવો પડશે. અને નગર રચના યોજના મુજબનાં ફાળાની ગણતરીના હેતુ માટે ફક્ત ખુલ્લી જમીન એટલે કે તે જમીન ઉપર કોઈ જાતનું બાંધકામ નથી તેમ સમજીને તેને નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમની કલમ લાગુ પડશે.

૨૨. અરજદારશ્રીએ ખોટી રજૂઆત અથવા ખોટા દસ્તાવેજી પુરાવા રજૂ કરેલ હશે તો આપેલ વિકાસ પરવાનગી આપોઆપ રદ થયેલ ગણાશે.

૨૩. જે હેતુ માટે પરવાનગી આપવામાં આવેલ છે. તે હેતુ માટે જ ઉપયોગ કરવાનાં રહેશે અન્ય હેતુ માટે ઉપયોગ કરવામાં આવશે તો પરવાનગી આપોઆપ રદ ગણાશે.

૨૪. આ પરવાનગીથી જે કામની પરવાનગી મળે છે તે કામે બીજા કોઈ ખાતાની પરવાનગી લેવી જરૂરી હશે તો તે મેળવી લેવાની શરતે આ પરવાનગી આપવામાં આવે છે.

૨૫. પ્રશ્નવાળી જમીનમાં આ અગાઉ મંજૂર થયેલ લે-આઉટ પ્લાન તથા હુકમની ખાત્રી કરી લેવાની રહેશે. અને થયેલ હોય તો અગાઉ મંજૂર થયેલ નકશાઓ રદ ગણવાનાં રહેશે. તેમજ જરૂરીવાઈએ હુકમ મેળવી લેવાનો રહેશે.

૨૬. કોમન પ્લોટ અને રસ્તાની જમીન હરરાજીથી, બક્ષિસથી કે અન્ય કોઈપણ રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વેંચાણ કે તબદીલ થઈ શકે નહીં. તેમજ હંમેશને માટે ખુલ્લી રાખવાની રહેશે.

૨૭. સલાલવાળી જમીનમાંથી/નજીકમાંથી પસાર થતાં ઈલેક્ટ્રીક લાઈન / ગેસલાઈન / વર્ગીકૃત રસ્તા/ સ્વેચ્છેનાલ/નદી-તળાવ વિગેરે બાબતે સંબંધિત ખાતાનો અભિપ્રાય / ના-વાંધા પ્રમાણપત્ર મેળવી તે રજૂ કરવાનો રહેશે. નાગદાર ગુજરાત હાઈકોર્ટના ચક્રાદા મુજબ વોટર બોડીઝથી જરૂરી જમીન અંતરો જાળવીને વિકાસ કરવાનો રહેશે.

TRUE COPY

ASHIT K. SONPAL
NOTARY, RAJKOT.

Page No. 11722
Serial No. 11722
Receipt No. 11722
Date. 09.11.2010

Page No. 86/2008
Serial No. 1955
Receipt No. 1955
Date. 10-11-2008

TRUE COPY

SARJUDAS J. DUDHREJIA
ADVOCATE & NOTARY
RAJKOT.





લે-આઉટ પ્લાનમાં કોમન પ્લોટ તથા રસ્તાની જમીનની માલિકી દરેક પ્લોટ હોલરની સહીયારી અથવા રૂડાની રહેશે. અને તેના મૂળ માલિકનો કોઈપણ જાતનો હક્ક રહેશે નહીં.
૨૯ લે-આઉટ પ્લાનમાં અત્રેની પુર્વ મંજૂરી વિના કોઈ ફેરફાર કરી શકાશે નહીં.

૩૦. બિનખેતી થયેલ પ્લોટ હોલરને પ્રાથમિક સુવિધા જેવી કે રસ્તા, પાણી, ગટર, પીવાના પાણીની લાઈન, વરસાદી પાણીના નિકાલ વ્યવસ્થા, ઘન કચરાના નિકાલની વ્યવસ્થા, સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા બિનખેતી કરનાર મૂળ માલિકે પોતાના ખર્ચે કરવાની રહેશે. જે આજથી બે વર્ષમાં પૂર્ણ કરવાની રહેશે.

૩૧. લે-આઉટ પ્લાનમાં ટિપ્પણ મુજબના દર્શાવેલ બાહ્ય હદોના માપો, તમામ ક્ષેત્રફળોની, હિસ્સાની, સ્થળ સ્થિતિની, પ્રવેશની હેયાત રસ્તાની તમામ ખર્ચ સક્ષમ સત્તાધિકારીશ્રી પાસેથી કરાવી લેવાની રહેશે. તથા આ અંગેની તમામ જવાબદારી આપની/જમીન માલિકની રહેશે.

૩૨. સરકારશ્રીના તા. ૨૯-૫-૦૧નાં ઠરાવ તથા વખતો વખતની અન્ય સૂચનાઓ અન્વયેના સ્ટ્રક્ચરલ સેફ્ટી અંગેના રેગ્યુલેશનને આધિન વિકાસ કરવાનો રહેશે.

૩૩. લે-આઉટ પ્લાનવાળી જમીનની માલિકીની, હક, હિત, હિસ્સાની ખર્ચ રેવન્યુ રાહે સક્ષમ સત્તાધિકારી પાસેથી કરાવી લેવાની રહેશે. તથા આ અંગેની સમગ્ર જવાબદારી આપની/જમીન માલિકની રહેશે.

૩૪. સક્ષમ અધિકારીશ્રી પાસેથી બિનખેતી હુકમ મેળવ્યા બાદ સક્ષમ લેન્ડ રેકર્ડ કચેરી પાસેથી મંજૂર થયેલ લે-આઉટ પ્લાન મુજબ પ્લોટ વેરીફિકેશન માપણી કરાવી, તેની પ્રમાણિત નકલ અત્રે રજૂ કરવાની રહેશે. જો તેમાં કોઈ પણ ફેરફાર જણાશે તો ફેરફાર મુજબ રીવાઈઝડ મંજૂરી અત્રેથી મેળવી લેવાની રહેશે.

૩૫. સવાલવાળી જમીનમાંથી તેમજ નજીકથી પસાર થતા લે-આઉટ પ્લાનમાં દર્શાવેલ તમામ હેયાત રસ્તા અને તેની પહોળાઈની અધિકૃત ખર્ચ કરાવી લેવાની તથા જમીન / પ્લોટોની આ હેયાત રસ્તાથી પ્રવેશ અંગેની મંજૂરીઓ, જમીન માલિકે સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવી લેવાની રહેશે. તથા આ અંગેની જવાબદારી આપની/જમીન માલિકની રહેશે.

૩૬. સદર વિસ્તાર ધરાવતી રાજકોટ શહેરના અન્વયે આ સત્તા મંડળ દ્વારા માપણી કમિટી દ્વારા જે માપણી રીપોર્ટ રજૂ કરવામાં આવેલ છે. બાવિષ્ય માં આ સત્તા મંડળ દ્વારા સ્કીમ બનાવવાનો દરિયા જે ફરવામાં આવે અને તે સંગે કી.સા.દ. અને સાર. સ્કેરી દ્વારા માપણી/રેકર્ડ પ્રમાણિત કરવા કોઈપણ ફેરફાર થશે તો તે તમામ ફેરફાર સ્વનિર્ણયે તમામ જમીન માલિકોને જાણ કરાવે રહેશે.

૩૭. રાજકોટ નીટવર્ક રીપેરેશન તંત્રીશ્રી દ્વારા રજૂ કરેલ દર્શાવેલ જમીન સ્થાપના સંબંધિત હેતુ માટે પુરસ્કૃત રાખવાની વહેંચણી તેમજ આ સત્તા મંડળ દ્વારા અંગણી થયેલ સદર જમીનો અત્રે સુપ્રત કરવાની રહેશે.

ઉપરોક્ત વિગતે લે-આઉટ પ્લાનની એક નકલ અત્રેની કચેરીમાં રાખેલ છે. અને એક નકલ કલેક્ટરશ્રી/જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાજકોટને મોકલાવી એક નકલ આ સાથે લે-આઉટ પ્લાન વિકાસ પરવાનગી પત્ર મંજૂરીની ભલામણ સાથે પરત કરેલ છે.

બિડાણ :- મંજૂર થયેલ લે-આઉટ પ્લાનની એક નકલ

નં-રૂડા/ટેક/ડેવ/કોહારોયા/૩૪૩૧૯૦

તા. - ૬-૨૦૧૭

નકલ સવિનય રવાના :-

(૧) કલેક્ટરશ્રી/જિલ્લા વિકાસ અધિકારીશ્રી, રાજકોટ જિલ્લો, રાજકોટ તરફ મંજૂરી અર્થે ભલામણ કરેલ લે-આઉટ પ્લાનની નકલ સહ જાણ સારુ તથા બિનખેતી થયે તેના હુકમ તથા પ્લાનની નકલ અત્રેથી કચેરીને પાઠવી આપવા વિનંતી.



ગુનીચર નગર નિયોજક
શહેરી વિકાસ સત્તામંડળ
રાજકોટ.